#080

સતત ચાલતા રહીએ..

ઘણો વખત આપણે માનીએ છીએ કે સફળતા માત્ર ટેલેન્ટ, લક કે ખાસ લોકો માટે જ હોય છે. પરંતુ સાચી વાત એ છે — સફળતા કોઈ જાદુ નથી, તે એક આદત છે.

દરરોજ થોડું કામ કરવું…
મન ના હોય ત્યારે પણ આગળ વધવું…
હાર મળ્યા પછી પણ ફરી ઊભા થવું…

આ બધું મળીને બનાવે છે “Consistency” — સતત પ્રયત્ન.

વિચાર કરો…
પાણીના ટીપાં સતત પડે તો પથ્થરમાં પણ છિદ્ર થઈ જાય છે. તો પછી આપણી મહેનત કેમ ફળ ના આપે?
આપે જ.

સફળ લોકો અને સામાન્ય લોકો વચ્ચેનો ફરક એટલો જ છે: સામાન્ય લોકો શરૂઆત કરે છે…
જ્યારે સફળ લોકો કાયમ માટે એ ચાલુ રાખે છે.

Perfect બનવું જરૂરી નથી
પરંતુ Regular બનવું ખૂબ જરૂરી છે

“થોડું કરો… પણ રોજ કરો.”

મિત્રો યાદ રાખીએ—
Consistency એ જ કોઈની પણ સૌથી મોટી શક્તિ છે